

August 7, 2025

To,
The Listing Compliance Department,
National Stock Exchange of India Limited,
'Exchange Plaza', C-1, Block G,
Bandra Kurla Complex [BKC],
Bandra [East], Mumbai – 400 051,
Maharashtra, India

Symbol: MACPOWER**Series: EQ****Subject: Intimation of publication of Un-Audited Financial Results for the Quarter ended June 30, 2025:**

Dear sir/Madam,

Pursuant to the provisions of Regulation 47 and other applicable provisions of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we submit herewith copies of newspaper advertisement of Un-Audited Financial Results for the Quarter ended June 30, 2025 published in The Financial Express newspaper (English and Gujarati Edition) on August 7, 2025.

The aforesaid results are also accessible on the Company's website at <https://macpowercnc.com/financials/>

Kindly take in your record and oblige us.

Thanking you.

Yours faithfully

For MACPOWER CNC MACHINES LIMITED

Rupesh Mehta
Chairman & Managing Director
DIN: 01474523**Encl:** a/a

+91 2827 287930/31
+91 7998 7998 16



sales@macpowercnc.com

**REGD. OFFICE :**

PLOT NO. 2234, NEAR KRANTI GATE,
GIDC, METODA – 360021.
RAJKOT, GUJARAT. (INDIA)



GOVERNMENT OF TAMIL NADU PUBLIC WORKS DEPARTMENT BUILDINGS (C&M) CIRCLE 2, CHEPAUK CHENNAI-5

Short term e-TENDER NOTICE No. 20 BCM/2025-26/DATED: 05.08.2025

FORM OF CONTRACT: LUMPSUM /Two Cover System

For and on behalf of the Governor of Tamil Nadu, Short term e-tenders are invited from the eligible registered contractors by the Superintending Engineer, PWD., Buildings (C & M) Circle 2, Chepauk, Chennai-5 for the following work:-

| Sr.No | Name of work and EMD | Approximate value of work | Period | Eligible Class |
|-------|--|---------------------------|------------------|--------------------------|
| 1. | Construction of Boys Hostel Building for 240 students with RCC Retaining wall and Filling of Low Level Area in the Tamil Nadu Dr.Ambedkar Law University at Perungudi, Chennai. E.M.D. : Rs. 11,90,300/- | Rs.2360.50 Lakhs | 15 Months | Class I and above |

- For Tender documents, visit <https://tntenders.gov.in>
- Last Date for submitting the application for site visit Certificate to the concerned Executive Engineer is on : 22.08.2025.
- Last Date and Time for submission of tender documents : 26.08.2025 upto 03.00 P.M.
- Date and Time of opening of the e-tender : 26.08.2025 at 04.00 P.M.

Superintending Engineer, PWD.,
Buildings (C&M) Circle 2, Chepauk, Chennai-5.

DIPR / 4116 / Tender / 2025

| | |
|---|---|
| JANA SMALL FINANCE BANK (A Scheduled Commercial Bank) | Registered Office: The Fairway, Ground & First Floor, Survey No.10/1, 11/2 & 12/2B, Off Domlur, Koramangala Inner Ring Road, Next to EGL Business Park, Challaghatta, Bangalore-560071. Regional Branch Office: Ground Floor, 208 to 213, 2nd Floor, Shangrila Arcade, Above Saraswat Temple, 100 Feet Anand Nagar Road, Shyamal, Ahmedabad, Gujarat-380015. |
|---|---|

Notice of Intention to Sell under Rule 8(5) & (6) of Security Interest Enforcement rules R/W Section 13 (8) of SARFAESI Act, 2002.

Whereas you the below mentioned Borrower/s, Co-Borrower/s, Guarantor/s and Mortgagees at Column No.2 have availed loans from Jana Small Finance Bank Limited, by mortgaging your immovable properties. Consequent to default committed by you all, your loan account has been classified as Non-performing Asset, whereas Jana Small Finance Bank Limited being a secured creditor under the Act, and in exercise of the powers conferred under section 13(2) of the said Act read with rule 2 of Security Interest (Enforcement) Rules 2002, issued Demand notice calling upon the Borrower/s/ Co-Borrower/s/ Guarantor/s/ Mortgagees as mentioned in column No.3 to repay the amount mentioned in the notices with future interest thereon within 60 days from the date service of notice, that upon failure on the part of the Borrower/ Co-borrower/ Guarantor/ Mortgagee in repaying the loan The undersigned authorised officer of Jana Small Finance Bank Limited has taken possession of the following property mentioned below by exercising of powers conferred under section 13(4) of the SARFAESI ACT on as mentioned in Column No.4. The Borrower/ Co-Borrower/ Guarantor/ Mortgagee in particular are informed and called upon to repay the outstanding balance as mentioned in Column No.5 within 30 days from the date of this notice.

| Sr. No. | Loan Account Number | Name of Original Borrower/ Co-Borrower/ Guarantor | Date of 13-2 Notice | Date of Possession | Current Outstanding balance as on 04.08.2025 |
|---------|--|--|---------------------|--------------------|--|
| 1 | 45259420003878 | 1) Abhishek Anil Mishra, 2) Usha Abhishek Mishra | 11/03/2025 | 23/05/2025 | Rs.11,48,172.60 (Eleven Lakh Forty Eight Thousand One Hundred and Seventy Two Rupees and Sixty Paisa) |
| 2 | 45188640000419 | 1) M/s. Aarya Developer (Proprietorship Firm), Through its Proprietor, Mr. Mitulbhai Veljibhai Patel, 2) Mr. Mitulbhai Veljibhai Patel, 3) Mrs. Rashmitaben Mitulbhai Patel, 4) Mrs. Ramaben Veljibhai Patel | 10/03/2025 | 20/07/2025 | Rs.42,68,256.65 (Forty Two Lakh Sixty Eight Thousand Two Hundred and Fifty Eight Rupees and Sixty Five Paisa) |
| 3 | 33369610000460 | 1) Amit Shivkumar Sharma, 2) Anikita Amit Sharma | 07/04/2025 | 12/06/2025 | Rs.32,38,718.00 (Thirty Two Lakh Thirty Eight Thousand Seven Hundred and Eighty Nine Rupees Only) |
| 4 | 45259420003690 45259410000422 | 1) Amitkumar Omprakash Mishra, 2) Sulochana Amitkumar Mishradipakbhai | 29/11/2024 | 29/07/2025 | Rs.23,45,757.90 (Twenty Three Lakh Forty Five Thousand Seven Hundred and Fifty Seven Rupees and Ninety Paisa) |
| 5 | 45229420003671 45229410000392 | 1) Bagdai Chetan Dilipbhai, 2) Bagdai Bhaktiben Chetanbhai | 15/03/2025 | 26/07/2025 | Rs.25,33,462.00 (Twenty Five Lakh Thirty Three Thousand Four Hundred and Sixty Two Rupees Only) |
| 6 | 31800440000246 | 1) Belim Rafikmyia Ahemadulla, 2) Belim Nasimbanu Ahemadulla | 15/03/2025 | 19/07/2025 | Rs.4,01,562.96 (Four Lakh One Thousand Five Hundred and Sixty Two Rupees and Ninety Six Paisa) |
| 7 | 45259420004042 | 1) Bhames Kirankumar, 2) Bhames Vinuben Kirankumar | 13/12/2024 | 05/03/2025 | Rs.10,95,958.40 (Ten Lakh Ninety Five Thousand Nine Hundred and Fifty Eight Rupees and Forty Paisa) |
| 8 | 30559610000076 30559630000072 | 1) Bhavesh Gunvantray Joshi, 2) Mita Bhaveshbhai Joshi | 10/03/2025 | 26/07/2025 | Rs.23,76,279.83 (Twenty Three Lakh Seventy Six Thousand Two Hundred and Seventy Nine Rupees and Sixty Three Paisa) |
| 9 | 30719610000430 | 1) Dhannia Palora, 2) Vinod Palora | 17/01/2025 | 26/03/2025 | Rs.11,56,603.00 (Eleven Lakh Fifty Six Thousand Six Hundred and Three Rupees Only) |
| 10 | 45259420000958 45259430000438 45259410000126 | 1) Dinesh Kesaramji Purohit, 2) Varshadevi Dinesh Purohit | 07/12/2024 | 05/03/2025 | Rs.11,90,017.00 (Eleven Lakh Ninety Thousand and Seventeen Rupees Only) |
| 11 | 45229420005510 | 1) Dodiha Akrambhai Mahemudbhai, 2) Dodiha Tanjila Akrambhai | 15/02/2025 | 13/07/2025 | Rs.18,96,525.98 (Eighteen Lakh Ninety Six Thousand Five Hundred and Twenty Five Rupees and Ninety Eight Paisa) |
| 12 | 45259610000093 | 1) Ganeshprasad Ramdevprasad Kushiwah, 2) Deepadevi Ganeshprasad | 10/01/2025 | 26/07/2025 | Rs.16,25,500.43 (Sixteen Lakh Twenty Five Thousand Five Hundred Rupees and Forty Three Paisa) |
| 13 | 45259420005351 | 1) Harshad Hasmmukhbhai Dobariya, 2) Hansaben Hasmmukhbhai Dobariya | 10/03/2025 | 19/05/2025 | Rs.9,49,154.76 (Nine Lakh Forty Nine Thousand One Hundred and Fifty Four Rupees and Seventy Six Paisa) |
| 14 | 49649420000186 | 1) Kadari Gulamhusen Siddikbhai, 2) Kajli Rifatkhusen Siddikbhai | 10/03/2025 | 10/03/2025 | Rs.26,54,867.00 (Twenty Six Lakh Fifty Four Thousand Eight Hundred and Sixty Seven Rupees Only) |
| 15 | 31029420005186 | 1) Ketan Himmatbhai Sorathiya, 2) Sorathiya Rasilaaben Himmatbhai | 18/02/2025 | 27/07/2025 | Rs.18,11,695.00 (Eighteen Lakh Eleven Thousand Eight Hundred and Ninety Five Rupees Only) |

| Sr. No. | Loan Account Number | Name of Original Borrower/ Co-Borrower/ Guarantor | Date of 13-2 Notice | Date of Possession | Current Outstanding balance as on 04.08.2025 |
|---------|--|---|---------------------|--------------------|---|
| 16 | 31029430000174 31029410000194 | 1) Laljibhai Dulabhai Makwana, 2) Makwana Jagrutiben Laljibhai | 07/04/2025 | 16/06/2025 | Rs.25,57,202.37 (Twenty Five Lakh Fifty Seven Thousand Two Hundred and Two Rupees and Thirty Seven Paisa) |
| 17 | 31489420001426 31489410000485 | 1) Luhar Vishanubhai Bababhai, 2) Gadaliya Rameshbhai Bababhai | 06/02/2025 | 20/07/2025 | Rs.10,31,084.40 (Ten Lakh Thirty One Thousand and Eighty Four Rupees and Forty Paisa) |
| 18 | 31809610000383 | 1) Mahida Ajitsinh Narsinh, 2) Manjulaben Ajitsinh Mahida | 17/02/2025 | 28/04/2025 | Rs.7,39,194.40 (Seven Lakh Thirty Nine Thousand One Hundred and Ninety Four Rupees and Forty Paisa) |
| 19 | 31529420002101 31529800000152 | 1) Masvaniya Dhiraj Vajuram, 2) Labhuben Vajuram Masvaniya | 10/03/2025 | 13/07/2025 | Rs.12,23,976.00 (Twelve Lakh Twenty Three Thousand Nine Hundred and Seventy Six Rupees Only) |
| 20 | 31489420002110 | 1) Mithapara Rameshbhai Gordhanbhai, 2) Mithapara Sandarbhan Rameshbhai | 23/05/2024 | 06/08/2024 | Rs.3,51,977.30 (Three Lakh Fifty One Thousand Nine Hundred and Seventy Seven Rupees and Thirty Paisa) |
| 21 | 30719610000522 | 1) Mulchandra Balram Yadav, 2) Vandana Yadav | 07/12/2024 | 27/07/2025 | Rs.12,61,379.82 (Twelve Lakh Sixty One Thousand Three Hundred and Seventy Nine Rupees and Eighty Two Paisa) |
| 22 | 45189420005798 | 1) Nasirrahman Niyaz Ahemad, 2) Alia Khatoun Ikhram Akhtar Shaikh | 10/01/2025 | 09/04/2025 | Rs.15,48,266.47 (Fifteen Lakh Forty Eight Thousand Two Hundred and Sixty Six Rupees and Forty Seven Paisa) |
| 23 | 45228640000627 | 1) Nimavat Kamalesh Chumilal, 2) Devang Kamleshbhai Nimavat, 3) Nimavat Milan Kamaleshbhai, 4) Nimavat Viralben Kamaleshbhai | 15/02/2025 | 12/07/2025 | Rs.79,95,642.82 (Seventy Nine Lakh Ninety Five Thousand Six Hundred and Forty Two Rupees and Eighty Two Paisa) |
| 24 | 31489420001021 31489410000472 33209410000112 33469800000566 | 1) Pandya Simran Umeshbhai, 2) Pandya Umeshbhai Hirabhai | 10/01/2025 | 12/07/2025 | Rs.16,42,778.78 (Sixteen Lakh Forty Two Thousand Seven Hundred and Seventy Eight Rupees and Seventy Eight Paisa) |
| 25 | 45189420005890 | 1) Pathan Hanifbhai Nizamuddin, 2) Pathan Julekhabai Mohammed Hanif | 15/02/2025 | 20/07/2025 | Rs.17,28,417.93 (Seventeen Lakh Twenty Eight Thousand Four Hundred and Seventeen Rupees and Ninety Three Paisa) |
| 26 | 310294200003450 | 1) Prakash Kumar Shankar Mishra, 2) Jayanti Devi | 10/01/2025 | 27/07/2025 | Rs.12,31,596.98 (Twelve Lakh Thirty One Thousand Five Hundred and Ninety Six Rupees and Ninety Eight Paisa) |
| 27 | 45259420004957 | 1) Prasad Ashokkumar Kamala, 2) Sheela Devi Ashokkumar | 07/12/2024 | 27/07/2025 | Rs.11,31,261.44 (Eleven Lakh Thirty One Thousand Two Hundred and Sixty One Rupees and Forty Four Paisa) |
| 28 | 31799610000132 | 1) Rathod Dahaji, 2) Rathod Taraben | 13/12/2024 | 26/07/2025 | Rs.5,30,527.76 (Five Lakh Thirty Thousand Five Hundred and Twenty Seven Rupees and Seventy Six Paisa) |
| 29 | 45259420005993 | 1) Roshankumar Anand Chaudhari, 2) Shantidevi Anand Chaudhari | 15/02/2025 | 27/07/2025 | Rs.11,13,904.86 (Eleven Lakh Thirteen Thousand Nine Hundred and Four Rupees and Eighty Six Paisa) |
| 30 | 45259420004500 | 1) Sanjaybhai Kishanbhai Nayaka, 2) Divyaben Sanjaybhai Nayaka | 13/12/2024 | 13/12/2024 | Rs.14,17,285.70 (Fourteen Lakh Seventeen Thousand Two Hundred and Eighty Five Rupees and Seventy Paisa) |
| 31 | 51819610000046 | 1) Shekh Rizvan Abdulmajid, 2) Shekh Farjana Rijavani | 15/03/2025 | 30/05/2025 | Rs.22,08,915.92 (Twenty Two Lakh Eight Thousand Nine Hundred and Fifteen Rupees and Ninety Two Paisa) |
| 32 | 31799630000786 | 1) Thakor Shaleshshish Somaji, 2) Liaben Somaji Thakor | 10/01/2025 | 03/04/2025 | Rs.28,76,636.23 (Twenty Eight Lakh Seventy Six Thousand Six Hundred and Thirty Six Rupees and Twenty Three Paisa) |

Please note Borrower/ Co-Borrower/ Guarantor/ Mortgagee are hereby notified to pay the sum as mentioned above along with up to date interest and ancillary expenses within 30 days from the date of Publication of this notice, failing which the above secured assets will be brought for sale by the authorised officer by exercising the powers conferred under Rule 8(6) & Rule 9 of the Security Interest Enforcement rules 2002.

Date: 07.08.2025, Place: Gujarat Sd/- Authorised Officer, For Jana Small Finance Bank Limited

MACPOWER CNC MACHINES LIMITED

CIN : L30009GJ2003PLC043419
PLOT NO.2234, NR. KRANTI GATE, GIDC METODA, TAL. LODHIKA DIST.RAJKOT-360007, GUJARAT
Tel : +91 2827 287930/3, E-Mail : cs@macpowercnc.com, Web: www.macpowercnc.com

EXTRACT OF FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30/06/2025 (Rs. In Lakh)

| Sr. No. | Particulars | Quarter Ended | | Year Ended | |
|---------|--|---------------|------------|------------|------------|
| | | 30.06.2025 | 31.03.2025 | 30.06.2024 | 31.03.2025 |
| | | Unaudited | Audited | Unaudited | Audited |
| 1 | Total income from operations (incl. other income) | 6,107.98 | 8,009.35 | 5,042.11 | 26,217.05 |
| 2 | Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items) | 610.88 | 1,266.36 | 541.85 | 3,540.08 |
| 3 | Net Profit / (Loss) for the period before tax (After Exceptional and/or Extraordinary items) | 610.88 | 1,189.66 | 541.85 | 3,463.38 |
| 4 | Net Profit / (Loss) for the period after tax (After Exceptional and/or Extraordinary items) | 455.57 | 859.58 | 401.67 | 2,544.17 |
| 5 | Total Comprehensive Income for the period | 452.38 | 858.75 | 397.63 | 2,520.75 |
| 6 | Paid-up Equity Share Capital (face value of Rs. 10/-) | 1,000.42 | 1,000.42 | 1,000.42 | 1,000.42 |
| 7 | Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year) | - | - | - | 13,282.00 |
| 8 | Earnings Per Share basic and Diluted | 4.55 | 8.59 | 4.02 | 25.43 |

Note: The above is an extract of the detailed form of Financial Results for the quarter ended filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full form of the Financial Results for quarter ended are available on the Stock Exchange websites (www.nseindia.com) & on Company's website <https://macpowercnc.com/financial>. The same can be accessed by scanning the QR Code provided here.

Place : METODA/RAJKOT For Macpower CNC Machines Limited,
Date : 07/08/2025 Sd/- Rupesh Mehta (Chairman & Managing Director)

Gujarat Power Corporation Limited,
Blok No. 8, 6th Floor, Udhogbhavan, Sector - 11, Gandhinagar - 382 011. Ph.: 079-23251255-60.
Fax No.: 079-23251254, www.gpcil.gujarat.gov.in

E-tendering

Tender No.: GPCIL/PD/2025-26/11

Gujarat Power Corporation Limited invites tender from reputed insurance companies for Various Insurance Policies for year 2025-26.

Please visit <https://gpcil.gujarat.gov.in> (Tender) for eligibility criteria, applying/downloading the tender document, and more details. The last date for submission of the tender will be 28/08/2025 till 18.00 hrs.

For, Gujarat Power Corporation Limited
Chief Project Officer

| | | |
|---|---|--|
| केनरा बँक (A Scheduled Commercial Bank) | Canara Bank (A Scheduled Commercial Bank) | Canara Bank Porbandar Branch : Kubar Landmark, Ground Floor, Opp. Sadhana Studio, SVP Road, Porbandar - 360 575 |
|---|---|--|

SYMBOLIC POSSESSION NOTICE

Whereas The undersigned being the Authorized Officer of the Canara Bank under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice Dated 26.05.2025 calling upon the Borrower Mr. Faizal Jamal Sandh (Borrower) to repay the amount mentioned in the notice, being Rs. 9,99,781.20/- (Rupees Nine Lakh Ninety Nine Thousand Seven Hundred Eighty One and Twenty Paise Only) as on 21.05.2025 plus further interest and charges thereon within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the Public in general, that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him / her under section 13 (4) of the said Act, read with Rule 8 & 9 of the said Rule on this 05th of August of the year 2025.

The Borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower in particular, and the Public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Canara Bank, Porbandar Branch for an amount of Rs. 9,99,781.20/- (Rupees Nine Lakh Ninety Nine Thousand Seven Hundred Eighty One and Twenty Paise Only) as on 21.05.2025 plus further interest and charges thereon.

Description of the Immovable Property

EMT of Captioned Property is a Residential Property in the limit of Porbandar-Chhaya Nagar Palika at Village Bokhira, Porbandar District, bearing Revenue Survey No. 782, 783, 784/1, land converted into Non Agriculture for Residential Purpose, known as "K.K. Nagar" palik, Residential Plot No. 85, its City Survey No. N47741/85 palik, its Land Sq. Mtr. 75.58, with existing structure thereon in the State of Gujarat, within Jurisdiction of the Sub - Registrar Porbandar and Bounded as under : Boundaries - East : 6.00 Mtrs. Wide Common Road, West : Adjoining Property of Plot No. 100, North : Adjoining Property of Plot No. 85 Palik (Part No. 11), South : Adjoining Property of Plot No. 84

Date : 05.08.2025, Place : Porbandar Sd/- Authorised Officer, Canara Bank

E-AUCTION SALE NOTICE

M/S ANIL LIMITED (IN LIQUIDATION)

Liquidator's Address : Sun Resolution Professionals Private Limited (SRPL) located at : 9-B, Varian Complex, Nr. Viral House, Lakhdi Circle, Navrangpura, Ahmedabad-380 014. Email: liq.anillimited@gmail.com

Notice for sale of the investments in quoted/ listed shares of the Corporate Debtor forming part of Liquidation estate formed by the Liquidator, appointed by the Hon'ble NCLT, Ahmedabad Bench under the Insolvency and Bankruptcy Code, 2016 and the regulations made thereunder.

| | |
|---|---|
| Date and Time of Auction | Monday, 25.08.2025 between 11:00AM to 12:00 PM |
| Last Date for Submission of Eligibility and EMD | Upto Friday, 22.08.2025 |
| Inspection Date & Time | Payable through website of the E-Auction provider Up to Friday 22.08.2025 till 6:00 PM, Contact the Liquidator on liq.anillimited@gmail.com |

| Lot No. | Particulars | a. Reserve Price b. EMD c. Bid Increment Amount (In Rs.) |
|---------|--|--|
| 1 | Sale of investments of Corporate Debtor in quoted/ listed shares viz. 12835 shares of GSFC of Rs. 5425 shares of Arvind Limited, 28700 shares of Bank of India, 1085 shares of Arvind Fashion Limited, 642 shares of Arvind Smartspaces Limited and 200 shares of The Anup Engineering Limited | a. Closing price as on 22.08.2025 minus 5% b. 5,00,000/- c. 25,000/- |

The detailed terms & conditions, e-auction application, tender document and other details of online auction are available on <https://baaneknec.com/> or by requesting through e-mail at liq.anillimited@gmail.com.

- Note:
- E-Auction will be conducted on "AS IS WHERE IS", "AS IS WHAT IS", "WHATEVER THERE IS" and "NO RECOURSE" basis through approved service provider, BAAANEKNET.
 - Prospective bidders shall submit the requisite documents, including a declaration of eligibility under Section 29A of the Insolvency and Bankruptcy Code, 2016 through electronic auction platform only.
 - Prospective bidders shall also submit the Earnest Money Deposit (EMD) through the electronic auction platform only.

Sd/-
CA Ramchandra Dallaram Choudhary
Liquidator of Anil Limited (In Liquidation)
IP Reg. No. 18B/INPA-001/NP-00157/2017-18/10326
Validity of AFA till 31.12.2025

| | | |
|---|---|--|
| केनरा बँक (A Scheduled Commercial Bank) | Canara Bank (A Scheduled Commercial Bank) | Canara Bank, Morbi Branch : Shop No. 10-14-22-26, Dhanraj Chamber, Nr. Pujara Telecom, NH-8, Morbi, Gujarat - 363 641 |
|---|---|--|

SYMBOLIC POSSESSION NOTICE

Whereas The undersigned being the Authorized Officer of the Canara Bank under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice Dated 31.05.2025 calling upon the Borrower Mrs. Varantben Rameshbhai Lagvadaya (Borrower) and Mr. Lagvadaya Rameshbhai Jashibhai (Co-Borrower) to repay the amount mentioned in the notice as on 31.05.2025 being Rs. 9,10,364.14/- (Rupees Nine Lakhs Ten Thousand Three Hundred Sixty Four and Fourteen Paise Only) in the Housing Loan Account plus further interest and other charges thereon, within 60 days from the date of receipt of the said notice.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the Public in general, that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him / her under section 13 (4) of the said Act, read with Rule 8 & 9 of the said Rule on this 06 August 2025.

The Borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Canara Bank, Morbi Branch for an amount as on 31.05.2025 being Rs. 9,10,364.14/- (Rupees Nine Lakhs Ten Thousand Three Hundred Sixty Four and Fourteen Paise Only) in the Housing Loan Account plus further interest and other charges thereon.

The Borrower's attention is invited to provisions of Section 13(8) of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Property

EMT of Residential House situated at Plot No. 27-38/13, Survey No. 155/1p2, Adjoining 54.79 Sq. Mtrs. At Village : Amreli, Taluka : Morvi, District : Morvi, Gujarat - 363 642. The Plot is Bounded by : North : By Plot No. 27 - 38/12 of this N.A. Land, South : By Plot No. 27 - 38/14 of this N.A. Land, East : By 7.50 Mtrs. Road of this N.A. Land, West : By Plot No. 27 - 38/24 of this N.A. Land

Date : 06.08.2025, Place : Morbi

Authorised Officer,
Canara Bank

| | |
|--|---|
| बैंक ऑफ बड़ोदा (A Scheduled Commercial Bank) | Shapur Branch, Rajkot : Survey No. 160/p-2, Plot No. 1, Near Sardar Chowk, Veraval-Shapur, Tal-Kotda Sangani, Dist-Rajkot. |
|--|---|

APPENDIX IV (See Rule 8(1)) Possession Notice (For Immovable Property)

Whereas, The undersigned being the Authorized Officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice Dated 22.05.2025 calling upon the Borrower Mr. Sagar Harshad Moraniya (Applicant) and Mrs. Pooja Sagar Moraniya (Co-applicant) Address : Flat No. 2/B, Sambhavanth Apartment, Opp. Jain Darasari, Ranchodh Nagar, Street 20/1, Rajkot, Gujarat - 360003, to repay the amount mentioned in the notice aggregating Rs. 24,58,063.93 (Rupees Twenty Four Lacs Fifty Eight Thousand Sixty Three and Ninety Three Paise Only) as on 18.05.2025 together with further interest thereon at the contractual rate plus costs, charges and expenses till date of payment with less recovery within 60 days from receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him/her under Sub Section (4) of Section 13 of the Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 1st day of Month August of the year 2025.

The Borrower / Partners / Guarantors / Mortgagees in particular and the Public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of Baroda for an amount of Rs. 24,58,063.93 (Rupees Twenty Four Lacs Fifty Eight Thousand Sixty Three and Ninety Three Paise Only)

■ આઈટી અને હેલ્થકેર શેરોમાં વેચવાલી

રિઝર્વ બેંકે વ્યાજ દર જાળવી રાખતાં સેન્સેક્સ ૧૬૦ પોઇન્ટ નીચે ઉતર્યો


પીટીઆઈ મુંબઇ, તા. ૬

બુધવારે રિઝર્વ બેંકે તેનો મુખ્ય રેપો દર ૬૨૫ થી ૬૨૫.૫૦ સેન્ટ સુધી ટેન્ડર રેપોમાં વેચવાલી વધતા બીએસઇ સેન્સેક્સ ૧૬૦ પોઇન્ટ ઘટ્યો હતો.

૩૦ જૂનનો સેન્સેક્સ ૧૬૬.૨૬ પોઇન્ટ કે ૦.૨૧ ટકા ઘટીને ૮૦,૫૪૩.૯૯ સેન્ટ સુધી હતો, સાથે તેના ૩૦માંથી ૧૮ શેરના ભાવ ઘટ્યા હતા અને ૧૨ શેરના ભાવ વધ્યા હતા.

રિવસ દરમિયાન, તે ૨૬૧.૪૩ પોઇન્ટ કે ૦.૩૨ ટકા ઘટીને ૮૦,૪૪૮.૮૨ ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.

૫૦-શેરનો એનએસઇ નિફ્ટી ૭૫.૩૫ પોઇન્ટ કે ૦.૩૧ ટકા ઘટીને ૨૪,૫૭૪.૨૦ બંધ થયો હતો. ઇન્ડા-૩ સેક્ટરમાં, ઇન્ડેક્સ



૧૧૦.૩૫ પોઇન્ટ કે ૦.૪૪ ટકા ઘટીને ૨૪,૫૩૯.૨૦ થયો હતો. સેન્સેક્સ કંપનીઓમાં, સન ફાર્માસ્યુટિકલ્સ, ટેક મહિન્દ્રા, એયસીએલ ટેકનોલોજીસ, ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, એઈનલ્સ, ટીસીએસ, અલ્પ્ટાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, તાતા સ્ટીલ, આઇટીસી અને એલ એન્ડ ટી શેરમાં મોટો ભાવ ઘટ્યો હતો.

જ્યારે એસિપન પેઇન્ટ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બીઇએલ,

અબ્બુડી પોલિસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ટ્રેન્ડ અને એચ ડીએક્સ બેંક શેરના ભાવ વધ્યા હતા.

પુએસમાંથી ઉદ્યોગના નવા ટ્રેડ રેન્જના છતાં--ગ્રેમેસિટક બજાર સ્થિતિસ્થાપક રહ્યા હતા અને ૨૪,૫૦૦ના મુખ્ય સપોર્ટ લેવલ નજીક રહ્યા છે.

હાર્મા સેક્ટર અન્ડરપ્રેશર્ડ રહ્યું છે અને ટેકિંગ યોગ્યતાની અસર રહી છે, તેમ જીપોજીટ ઇન્વેસ્ટમેન્ટ્સના રિસર્ચ હેડ વિનોદ નાપરે જણાવ્યું

હયું.

એસિપન બજારમાં, જાપાનનો નિફી ૨૨૫, સાંધાઇનો એક્સએક્સ કોમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હોંગકોંગ સકારાત્મક ટેકિટીમાં બંધ રહ્યા હતા, જ્યારે સાર્વિક કોરિયાનો કોસ્પી ટેકેલા વધારો સેન્ટ સુધી હતો.

યુરોપિયન બજારો ગ્રીન ટેકિટીમાં ટ્રેડિંગ કરી રહ્યા હતા.

મંગળવારે પુએસ બજારો ઘટ્યા હતા. વૈશ્વિક ઓઇલ બેંચમાર્ક-બ્રેન્ટ ક્રુડમાં ૧.૬૧ ટકા ઉછળીને ભાવ બેરલદીઠ ૬૮.૭૩ પુએસ ડોલર થયા હતા.

વિદેશી સંસ્થાકીય સોફ્ટવેર કંપનીઓમાં મંગળવારે રૂપિયા ૨૨.૪૮ કરોડની કિંમતના શેરો વેચ્યા હતા, જ્યારે ડેમેસિટક સંસ્થાકીય સોફ્ટવેર કંપનીઓમાં રૂપિયા ૩.૮૪૦.૩૯ કરોડની કિંમતના શેરો ખરીદ્યા હતા, તેમ એક્સએચ-૩૬માં કાર્યાવાજ્યું હતું.

ભારતીય ચલણની આગેકૂચ

રૂપિયો યુએસ ડોલર સામે ૧૫ પૈસા વધીને ૮૭.૭૩ના સ્તરે બંધ રહ્યો

પીટીઆઈ મુંબઇ, તા. ૬

બુધવારે અસ્થિર ગ્રીનબેન્કને પગલે અને ભાજ ૬૨ સ્થિર રાખવાના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિર્ણયની સહાયથી પુએસ ડોલર સામે રૂપિયો વિક્રમજનક નીચી સપાટીએથી રિકવર થઈને ૮૭.૭૩ (પ્રોવિઝનલ) ૫૨ ૧૫ પૈસાની ઊંચી સપાટીએ બંધ થયો હતો.

જોકે, ફૂડ ઓઈલના વધી રહેલા ભાવો, નફાસત્ત્વક સ્થાનિક ઈફિયટી બજારો અને ભારત પર પુએસ ટેકિટી મામલે પ્રવર્તી સ્થેતી અનિશ્ચિતતાને કારણે ભારતીય ચલણની વૃદ્ધિ સીમિત રહી હોવાનું હોરેક્સ ટ્રેડર્સ જણાવ્યું હતું.

ઈન્ટરનેશનલ ફોરેન એક્સચેન્જ પર રૂપિયો ૮૭.૭૨ પર ખૂલ્યો હતો અને રિવસ દરમિયાન ૮૭.૬૩થી ૮૭.૮૦ની રેન્જમાં પહોંચીને



૮૭.૭૩ (પ્રોવિઝનલ) પર બંધ રહ્યો હતો, આમ, તે તેના આગલા બંધ કરતાં ૧૫ પૈસા ઊંચકાયો હતો.

મંગળવારે રૂપિયો ૬૨ થી વખત તેની અત્યાર સુધીની સૌથી નીચી ઇન્ડા-૩ સપાટીએ પહોંચ્યો હતો અને પુએસ ડોલર ૨૨ પૈસા ઘટીને ૮૭.૮૮ નોંધાયો હતો. સર્વેચ ૩ ભાજ ૬૨ કાપ પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ બુધવારે પોલિસી રેટ ૫.૫ ટકાના દરે ધરાવતા સમવાનો નિર્ણય લઈને ટેકિટીમાં

અનિશ્ચિતતા અંતે પ્રવર્તી સ્થેતી ચિંતાઓ વચ્ચે તેનું તકસર વળાંક જાળવી રાખ્યું હતું. ચાલુ નાણાંકીય વર્ષની ગ્રીક ટ્રિન્નાસિક નાણાંવિષયક નીતિની જાહેરાત કરતાં આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે, નાણાંકીય વર્ષ ૨૦૨૬ માટે વૃદ્ધિ દરનો અંદાજ ૬.૫ ટકાએ જાળવી રાખવામાં આવ્યો છે. રૂપિયો આજે સાંકડી રેન્જમાંથી પસાર થયો હતો ત્યારે રશિયા પાસેથી ઓઈલની ખરીદી કરવા મફત ભારત

પર શાનુ કરવામાં આવતા પેનલ ટેકિટી અને સહ જોઈ રહ્યાં છીએ. આવતીકાલે માટે રૂપિયો ૮૭.૨૫થી ૮૮ની રેન્જમાં રહેશે, એવી અમને પેલા છે, એમ ફિનરેક્સ ટ્રેડર્સી એડવાઈઝર્સ એલએલપીના હેડ ઓફ ટ્રેડર્સી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનિલ કુમાર બનસાલીએ જણાવ્યું હતું.

આ દરમિયાન, બ્રેન્ટ ક્રુડની કિંમત કુચર ટ્રેડમાં ૧.૪૫ ટકા ચીંકાઈને ૬૮.૧૨ ડોલર પ્રતિ બેરેલે પહોંચી હતી. ઉદ્યોગનીય છે કે, ભારત સામે રેપાર મામલે નવી થમકી ઉભારતાં પ્રમુખ ગ્રેનાથક ડમ્પે સોમવારે કહ્યું હતું કે, તેઓ ભારત પર થરખમ પુએસ ટેકિટી ઝીંકશે.

એટલું જ નહીં, તેમણે ભારત પર સંશ્લેષન ઓઈલની મોટાપાયે ખરીદી કરીને તબક્કે નહોતી લેવા માટે તેનું વેચાણ કરવાનો પણ આશય મુક્યો હતો.

સોનાના વાયદાના ભાવોમાં રૂ.૫૩૭ અને ચાંદીમાં રૂ.૨૭૬નો સુધારો

કોમોડિટી બ્યુરો મુંબઇ, તા. ૬

દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ કન્ટ્રાક્ટ્સમાં, રૂ.૬૫૬૩૭.૬૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.૧૧૨૭૫.૩૫ કરોડનાં કામકાજ છયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.૫૪૩૬૦.૬ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો રૂ.૩૪૦૪૪ પોઈન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ મીમિયમ ટર્નઓવર રૂ.૮૬૧.૬૨ કરોડનું જણ્યું હતું. કીમતી પાતુઓમાં સોના ચાંદીના વાયદાઓમાં રૂ.૮૮૮૬.૮૩ કરોડનાં કામકાજ છયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૧૩૨૯ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૧૦૧૩૨૯ અને નીચામાં રૂ.૧૦૦૬૬૦ના સ્તરે સ્પર્શી, રૂ.૧૦૧૩૩૮ના આગલા બંધ સામે રૂ.૫૩૭ ઘટી રૂ.૧૦૦૮૦૧ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-મિની ઓગસ્ટ વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૨૯૫ ઘટી રૂ.૮૦૪૯૦ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૩૭ ઘટી રૂ.૧૦૦૮૦ જાયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૭૮

ઘટી રૂ.૧૦૦૨૮૦ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટ્રેન ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૦૮૫૨ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૧૦૦૮૫૨ અને નીચામાં રૂ.૧૦૦૮૭૫ના મહાભે અછડાઈ, રૂ.૧૦૦૮૯૦ના આગલા બંધ સામે રૂ.૪૬૦ ઘટી રૂ.૧૦૦૪૩૦ જાયો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૧૩૪૩૩ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૧૧૩૫૩૦ અને નીચામાં રૂ.૧૧૨૮૨૮ના સ્તરે સ્પર્શી, રૂ.૧૧૩૫૦૪ના આગલા બંધ સામે રૂ.૨૭૬ ઘટી રૂ.૧૧૩૨૮૦ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.૨૧૫ ઘટી રૂ.૧૧૨૯૯૫ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઈકો ઓગસ્ટ વાયદો રૂ.૨૪૨ ઘટી રૂ.૧૧૨૯૯૦ જાયો હતો. એનજી સેગમેન્ટમાં રૂ.૧૫૩૯.૬૧ કરોડનાં કામકાજ છયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.૪૪૫૮ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૪૪૬૩ અને નીચામાં રૂ.૪૪૪૩ના સ્તરે સ્પર્શી, રૂ.૬ ઘટી રૂ.૪૪૫૯ જાયો હતો. ફૂડ તેલ ઓગસ્ટ વાયદો બેરલદીઠ રૂ.૫૭૪૪ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૫૮૨૮ અને નીચામાં રૂ.૫૭૪૮ના મહાભે અછડાઈ, રૂ.૫૭૪૮ના આગલા બંધ સામે રૂ.૭૭ વધી



રૂ.૫૮૨૫ જાયો હતો. ફૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.૭૭ વધી રૂ.૫૮૨૦ના ભાવે ટ્રેડલઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.૫.૯ ઘટી રૂ.૨૬૦.૧ જાયો હતો. નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો રૂ.૫.૬ ઘટી રૂ.૨૬૦.૫ જાયો હતો. રૂપિયો-ડોલર વાયદાઓમાં મેન્જા તેલ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.૯૪૮ના ભાવે ખૂલી, રૂ.૬ ૧ ઘટી રૂ.૯૪૫.૯ જાયો હતો. કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.૬૪૩૧.૫૭ કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.૨૫૫૫.૨૬ કરોડનાં કામકાજ છયાં હતાં. તાંબાના વાયદાઓમાં રૂ.૩૩૭.૪૯ કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના

વાયદાઓમાં રૂ.૭૨.૮૧ કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.૨૨.૮૧ કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.૧૬૦.૩૮ કરોડનાં કામકાજ છયાં હતાં. ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.૭.૩૧ કરોડનાં કામકાજ છયાં હતાં. ફૂડ તેલ અને ફૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.૪૪૪.૬૪ કરોડનાં કામકાજ છયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.૧૦૭.૬૬ કરોડનાં કામ છયાં હતાં. મેન્જા તેલના વાયદામાં રૂ.૩.૪૮ કરોડનાં કામ છયાં હતાં. ઓપન ઇન્વેસ્ટ સોનાના વાયદાઓમાં ૧૫૬૫૮ લોટ, રૂ.૩૫૦ પોઈન્ટના સ્તરે સ્પર્શી, ૯૮ પોઈન્ટ ઘટી રૂ.૩૪૦૪ પોઈન્ટના સ્તરે હતો. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ફૂડ તેલ

ઓલ-ટ્રેનના વાયદાઓમાં ૧૫૮૦૧ લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં ૨૦૭૫૧ લોટ, ૪૪૬૪૨ લોટ અને ચાંદી-માઈકો વાયદાઓમાં ૧૫૬૫૮ લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં ૭૫૨ લોટ, ફૂડ તેલના વાયદાઓમાં ૧૧૧૬૪ લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં ૪૫૪૭૧ લોટના સ્તરે રહ્યો હતો. ઇન્ડેક્સ કન્ટ્રાક્ટ્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓગસ્ટ વાયદો રૂ.૩૪૭૪ પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં રૂ.૩૪૭૪ પોઈન્ટના સ્તરે અને નીચામાં રૂ.૩૪૭૪ પોઈન્ટના સ્તરે સ્પર્શી, ૯૮ પોઈન્ટ ઘટી રૂ.૩૪૦૪ પોઈન્ટના સ્તરે હતો. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ફૂડ તેલ

ઈન્ડેક્સ આગામી વર્ષમાં આઈપીઓ

૨જૂ કરશે

પીટીઆઈ

હેડલાઇન, તા. ૬

સોલાર પીવી ઉત્પાદક અને ટિચર ટી સી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની સંપૂર્ણ પાકિસ્તાની પેટાકંપની ઈન્ડેક્સ સોલાર પ્રાઈવેટ લિમિટેડ આંધ્ર પ્રદેશમાં કંપનીની ઘાજની નિર્માણપીના ૧ ગીયાવોટની લાઈન ચાલુ થઈ ગયા પછી આગામી નાણાંકીય વર્ષમાં આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ) બહાર પાડવાનું આયોજન કરી રહી છે. ટિચર ટી સી ઇલેક્ટ્રિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એન વિશેષ્વર રેડ્ડીએ કહ્યું હતું કે, ઈન્ડેક્સ સોલાર પ્રોડક્શન લિમ્ડ ઈન્ફર્વિવ (પીએલઆઈ) સ્કીમ હેઠળ માન્યતા ધરાવે છે અને તેને બે ભાગમાં કુલ રૂ. ૫૫.૧૭ કરોડના લાભ મળ્યા છે. ઈન્ડેક્સ ક્વાર્ટરથી પીવી મોડ્યુલ સુધીની સમગ્ર પ્રક્રિયાને આવરી લઈને ગીયા-સેલથી પુર્ણ એકીકૃત સોલાર પીવી ઉત્પાદન સુવિધા વિકસાવીને ભારતના સોલારના શ્રેયમાં અગ્રણી મેથાડી બનવાનો આશય ધરાવે છે.

પ્રેસ્ટિજ, આનંદ રાહી શેરને આઈપીઓ માટે લોન્ચ

કરવા માટે સેબીની મંજૂરી

પીટીઆઈ

નવી દિલ્હી, તા. ૬

પ્રેસ્ટિજ ઓપ્થિલાસિટી વેન્ચર્સ અને આનંદ રાહી શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ સહિતની પાંચ કંપનીઓએ આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ) થકી બંડ્રોલ ઊંચું કરવા માટે સેબીની મંજૂરી મેળવી હોવાનું મુદ્દી બજારની અપડેટના આધારે બુધવારે જાણવા મળ્યું હતું.

નિયમનકારી મંજૂરી મેળવનારી અન્ય કંપનીઓમાં એસએસએફ પ્લાસ્ટિક્સ ઈન્ડિયા, મુજરાલ કિંગ્ડો એન્ડ સુપર સ્પેશિયલિટી તથા ઈન્ક પ્રિંટ ટેકનોલોજીઓ સમાવેશ થાય છે. જાન્યુઆરી અને એપ્રિલની વચ્ચેના ગાળામાં પ્રાથમિક આઈપીઓ પેપર્સ જાજીવ કરનારી આ કંપનીઓએ સહાય દરમિયાન

સેબીનાં અવલોકનો મેળવ્યાં હોવાનું અપડેટના આધારે માહુમ પડ્યું હતું.

સેબીની પરિભાષામાં અવલોકનો મેળવવાં એ પબ્લિક ઈશ્યુની પ્રક્રિયામાં આવજ વધવા સમાન છે.

ટિચર ટી સી પ્રેસ્ટિજ એસ્ટેટ્સ પ્રોજેક્ટ્સની પાંચ પ્રેસ્ટિજ ઓપ્થિલાસિટી વેન્ચર્સ તેના આઈપીઓ થકી રૂપિયા ૨,૭૦૦ કરોડ ઊંચા કરવાનો આશય ધરાવે છે, જેમાં રૂપિયા ૧,૭૦૦ કરોડના મુલ્યાન ઈકિવટી શેરોના ફેશ ઈશ્યુઅન્સ તથા રૂપિયા એક હજાર કરોડના મુલ્યાન ઈકિવટી શેરોના બોન્ડ્સનેસનો સમાવેશ થતો હોવાનું ગ્રીનારએમપીમાં જણાવવામાં આવ્યું હતું.

ઓએફએસમાં પ્રમોટર પ્રેસ્ટિજ એસ્ટેટ્સ પ્રોજેક્ટ્સ લિમિટેડ ક્લસ ઈકિવટી શેરોનો સમાવેશ થાય છે.

ફાઇનાન્સિયલ ઇન્ડિયા લિમિટેડ

ENGINEERS INDIA LIMITED

(A Govt of India Undertaking)

Regd. Office: Engineers India Bldg., 1, Bikanji Cama Place, New Delhi - 110066

NOTICE TO PHYSICAL SHAREHOLDERS

(Special Window for Re-Lodgement of Transfer Requests of Physical Shares)

SEBI, vide circular no. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated July, 02, 2025, has allowed opening of a special window to facilitate re-lodgement of transfer requests of physical shares lodged prior to the deadline of 1st April 2019 and rejected / returned due to deficiencies in documents.

Key details:

| | |
|---|--|
| Window for re-lodgement | 7 th July 2025 to 6 th January 2026 |
| Who can re-lodge the transfer requests? | Investor whose transfer deeds were lodged prior to 1 st April, 2019 and rejected/returned due to deficiencies in documents. |
| How to re-lodge the transfer requests? | Submit original transfer documents, along with corrected or missing details to the Registrar and Share Transfer Agent, M/s Ananki Assignments Limited. |
| Postal Address | 205-208, Anarkali Complex, Jhandewalan Extension, New Delhi-110066 |
| Helpline No. | Tel No.: 011-42541234 |
| For any queries | Send email at vrndran@ananki.com or company.secretary@eil.co.in |

The shares that are re-lodged for transfer shall be issued only in demat mode.

For Engineers India Limited

Sd/-

Date: 06.08.2025
Place: New Delhi

S. K.Padhi
Company Secretary & Compliance Officer

જાવે આપ

પાનુ ગ્રાહક

NARMADA AGROBASE LIMITED

(L16494GJ2013PLC073468)

Regd office: 613/P-1, U Park (Jethaji) Dhangra Road, Tal. Jotana, Mahesana Gujarat 384421 India

Email: info@narmadaagrobase@gmail.com • website: www.narmadaagrobase.com

STATEMENT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30th JUNE, 2025

(Rs. in Lakhs)

| Particulars | Quarter Ended | | Year Ended | |
|--|---------------|------------|------------|------------|
| | 30.06.2025 | 31.03.2025 | 30.06.2024 | 31.03.2024 |
| | Unaudited | Audited | Unaudited | Audited |
| Total Income from operations | 1,141.34 | 2,861.48 | 1,227.17 | 6,833.91 |
| Profit/(loss) before exceptional items and tax | 136.18 | 68.98 | 129.42 | 515.66 |
| Profit/(loss) before tax | 136.18 | 68.98 | 129.42 | 515.66 |
| Profit/(loss) for the period after tax | 101.90 | 77.60 | 101.59 | 408.79 |
| Total Comprehensive income for the period | 101.90 | 77.60 | 101.59 | 408.79 |
| Paid-up equity share capital | 3,793.64 | 3,793.64 | 1,354.67 | 3,793.64 |
| Earnings per equity share (Basic & Diluted) | 6.27 | 6.30 | 0.75 | 1.56 |

Note:

1. The above is an extract of the detailed format of the financial results filed with the Stock Exchanges under regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results are available on the company's website (www.narmadaagrobase.com) and Stock Exchanges websites (www.seindia.com) and (www.bseindia.com)

2. The above result has been reviewed by Audit Committee and approved by Board of Directors at its Meeting held on 6th August, 2025.

For: Narmada Agrobase Limited

Sd/-

Neerajkumar Sureshchandra Agrawal

Chairman and Managing Director (DIN: 06473290)

Date: 6th August, 2025

Place: Ahmedabad

MACPOWER CNC MACHINES LIMITED

CIN : L30009GJ2003PLC043419

PLOT NO.2234, MR. KRNATI GATE, GIDC METCOA, TAL. LODHIKA DISTRAJKOT-360007, GUJARAT

Tel : +91 2827 287330/3, E-Mail : cs@macpowercnc.com, Web: www.macpowercnc.com

EXTRACT OF FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30/06/2025

(Rs. in Lakh)

| Sl. No. | Particulars | Quarter Ended | | Year Ended | |
|---------|--|---------------|------------|------------|------------|
| | | 30.06.2025 | 31.03.2025 | 30.06.2024 | 31.03.2025 |
| | | Unaudited | Audited | Unaudited | Audited |
| 1 | Total income from operations (incl. other income) | 6,107.96 | 6,009.35 | 5,042.11 | 26,217.05 |
| 2 | Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items) | 610.88 | 1,266.35 | 541.65 | 3,540.08 |
| 3 | Net Profit / (Loss) for the period before tax (After Exceptional and/or Extraordinary items) | 610.88 | 1,189.66 | 541.65 | 3,463.38 |
| 4 | Net Profit / (Loss) for the period after tax (After Exceptional and/or Extraordinary items) | 455.57 | 859.58 | 401.67 | 2,544.17 |
| 5 | Total Comprehensive Income for the period | 452.38 | 858.75 | 397.63 | 2,520.75 |
| 6 | Paid-up Equity Share Capital (face value of Rs. 10/-) | 1,000.42 | 1,000.42 | 1,000.42 | 1,000.42 |
| 7 | Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year) | - | - | - | 13,282.00 |
| 8 | Earnings Per Share basic and Diluted | 4.55 | 8.59 | 4.02 | 25.43 |

Note: The above is an extract of the detailed format of Financial Results for the quarter ended filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results for quarter ended are available on the Stock Exchange websites (www.seindia.com) & on Company's website (macpowercnc.com/financial). The same can be accessed by scanning the QR Code provided below.

Place : METCOA/PAJKOT

Date : 07/08/2025

For Macpower CNC Machines Limited,

Sd/- Rupesh Mehta (Chairman & Managing Director)